

ત્વરિત જાહેરાત માટે

## બ્રમ્પટન સિટી કાઉન્સિલ લે છે અશ્વેત વિરોધી રંગભેદ સામે પગલાં

*સિટી શરૂ કરે છે અશ્વેત આફ્રિકન અને કેરિબિઅન સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સશક્તિકરણ અને અશ્વેત વિરોધી રંગભેદ યુનિટ*

બ્રમ્પટન, ઓન્ટારિયો (11 જૂન 2020) – બ્રમ્પટન સિટી કાઉન્સિલે પોતાની ગઈકાલની સભામાં સિટીની સહુ પ્રથમ અશ્વેત આફ્રિકન અને કેરિબિઅન સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સશક્તિકરણ અને અશ્વેત રંગભેદ વિરોધી રંગભેદ યુનિટનો પ્રારંભ કર્યો હતો જેથી અશ્વેત વિરોધી રંગભેદ સામે અર્થવાહક પગલાં લઈ શકાય.

બ્રમ્પટનના વૈવિધ્ય ધરાવતા અશ્વેત આફ્રિકન અને કેરિબિઅન લોકસમૂહ દ્વારા માર્ગદર્શન મેળવીને આ એકમ અગ્રીમતાઓ સ્થાપિત કરશે અને એક એક્શન પ્લાન બનાવશે જે બ્રમ્પટન ખાતેના ગળથુથીના અશ્વેત વિરોધી રંગભેદને નાબૂદ કરશે અને અશ્વેત સમાજની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સ્થિતિની ઉન્નતિ કરશે.

બ્રમ્પટનનો અશ્વેત આફ્રિકન અને કેરિબિઅન સમાજ બ્રમ્પટનના સાંસ્કૃતિક વૈવિધ્યમાં જીવંત અને સક્રિય યોગદાન આપે છે અને શહેરનું બીજા ક્રમનું સહુથી મોટું દ્રશ્યમાન જૂથ ગણાય છે જેમની વધતી વસ્તી 80,000 કરતા વધુ રહેવાસીઓની છે.

સિટી જેમ જેમ અશ્વેત વિરોધી રંગભેદ યુનિટનો વિકાસ કરશે ત્યારે વધુ જાણકારી મેળવવા માટે અને તેમાં સામેલ થવામાં પોતાની રૂચિ દર્શાવવા કૃપા કરી અહીં સિટીનો સંપર્ક કરો [AntiBlackRacismUnit@brampton.ca](mailto:AntiBlackRacismUnit@brampton.ca). આ એક અગત્યની પહેલ છે જે CAOના કાર્યાલય દ્વારા મેયર અને કાઉન્સિલ તેમજ સમુદાયના હિસ્સેદારોનો સહયોગ મેળવીને ચલાવાશે.

આ પ્રક્રિયામાં સમાજ પોતાનો મત પ્રવૃત્ત કરે અને જણાવે તે માટેની તકો જાહેર કરવામાં આવશે.

### અવતરણો

"સાર્વજનિક હોદ્દારો તરીકે, અમારે કેવા ઉચ્ચ ધોરણો અમારા સત્તાના હોદ્દાઓ પરથી દર્શાવવા જોઈએ તેનાથી અમે બિલકુલ વાકેફ છીએ. આ વિશેષાધિકારને અમે હળવાશથી નથી લેતા. અમે રંગભેદ વિરોધી છીએ એટલું માત્ર બોલવું પર્યાપ્ત નથી, અમારે તેનું નિદર્શન અર્થપૂર્ણ પગલાં લઈને કરવાનું રહેશે જે એવા વાસ્તવિક પરિણામો લાવે કે આપણા અશ્વેત આફ્રિકન અને કેરિબિઅન સમુદાયો ઉન્નત થઈ શકે તેમજ તેમનું સશક્તિકરણ કરી શકાય. આ યુનિટનું સર્જન અને ત્યારબાદનો એક્શન પ્લાન સાચી સમાનતા અને ન્યાય તરફ જવાનું અગત્યનું પ્રથમ પગલું છે જે માત્ર આપણા શહેર પુરનું મર્યાદિત ન રહેતા તેની સીમા પાર પણ જશે.

- પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન

"દરખાસ્તો કરવી એક રીત છે જેનાથી સિટી કાઉન્સિલના અગિયાર સદસ્યો સિટીના કર્મચારીગણને મહત્વપૂર્ણ નીતિ વિષયક બાબતોમાં દિશાનિર્દેશો આપી શકે. છ વિરુદ્ધ પાંચ મતો રહેવાસીઓને જાણ કરે છે કે કાઉન્સિલની બહુમતિ વિશિષ્ટ નીતિ નિર્દેશને ટેકો આપે છે. આ દરખાસ્તને કાઉન્સિલ દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. સંદેશ સ્પષ્ટ અને સાફ છે. અશ્વેતો મહત્વપૂર્ણ છે અને ગળથુથીમાં રહેલ રંગભેદનો સિટી ઓફ બ્રમ્પટનના તમામ સ્તરો પરથી સામનો કરવામાં આવશે. મને ગૌરવ છે કે હું એવી સિટી કાઉન્સિલની સદસ્યા છું જેમણે આ નિર્ણાયક અને ઐતિહાસિક પગલું લીધું છે અને કાર્ય હજુ શરૂ થયું છે."

- શેરમેન વિલિયમ્સ (Charmaine Williams) સીટી કાઉન્સિલર, વોર્ડ 7& 8

"આપણા સમાજમાં વાસ્તવિક પરિવર્તન લાવવા માટે આપણે સુનિશ્ચિત કરવું રહ્યું કે આપણા સંગઠનના મૂલ્યો અને લક્ષ્યો બ્રમ્પટનમાં જે દર્શાવવાજોગ છે તેની સાથે સંરખિત છે – એક સમાવેશિત શહેર જે પોતાના સાંસ્કૃતિક વૈવિધ્યને વધાવે છે અને અશ્વેત રંગભેદ કે કોઈપણ પ્રકારના ભેદભાવ બિલકુલ ચલાવી લેતું નથી. આપણા શહેરની આ વાસ્તવિક સમસ્યાઓ વિશેની નિખાલસ ચર્ચાઓ મારફત આપણે અહીં રહેતા અને કામ કરતા લોકો માટે એક સમાનતાલક્ષી અને ન્યાયોચિત સંજોગો ઊભા કરી શકીશું."

- ડેવિડ બાર્રિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રમ્પટન

"કેન્યન કેનેડિયન અસોસિએશન બ્રમ્પટનનાં મેયરશ્રી સન્માનનીય પેટ્રિક બ્રાઉનનું તેમજ તેમની સમગ્ર કાઉન્સિલનું અભિવાદન કરે છે કે તેઓએ દરખાસ્તને બહાલી આપીને એવા ધોરણોને ગતિ આપી છે જેનાથી તમામ બ્રમ્પટનવાસીઓ માટે સમાનતાનો પાયો નાંખવાનો માર્ગ ખોલશે. આ દરખાસ્ત સિટીની નેતાગીરીની અશ્વેત વિરોધી રંગભેદને નાબૂદ કરવાની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે અને આખા દેશમાં અન્ય શહેરોને સીમાચિહ્નરૂપે દાખલો પુરો પાડશે. KCA સિટી સાથે સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સશક્તિકરણમાં સુધારા લાવવાના એકધારા પ્રયાસો અને અમલીકરણ માટે કાર્ય કરવા માટે આતુરતાથી રાહ જુએ છે જે માત્ર નિવાસી અશ્વેત આફ્રિકનો માટે જ નહીં પરંતુ આપણા મહાન દેશમાં આવતા નવા લોકો માટે પણ છે."

- એફાઈમ મ્વાઉરા, પ્રમુખ, કેન્યન કેનેડિયન અસોસિએશન

"નાઈજેરિયન કેનેડિયન અસોસિએશનને પણ આઐતિહાસિક પહેલ વિશે આનંદની લાગણી થાય છે. આ પહેલથી ખરેખર આપણે સાથે મળીને બ્રમ્પટનને આકાર આપી શકીશું."

- જ્યોર્જ યુકુ, પ પ્રમુખ, નાઈજેરિયન કેનેડિયન અસોસિએશન

"રૂટ્સ કમ્યુનિટી સર્વિસિસ ઈન્ક (Roots Community Services Inc) ને તે જાનતા આનંદ થાય છે કે સિટી ઓફ બ્રમ્પટન ખાતે અશ્વેત આફ્રિકન અને કેરિબિયન સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સશક્તિકરણ અને અશ્વેત રંગભેદ વિરોધી રંગભેદ યુનિટ શરૂ થઈ રહ્યું છે. આ પોકારનો સ્વીકાર કરીને પ્રસ્તુત કરવા બદલ મેયર બ્રાઉન અને તમામ કાઉન્સિલરોનો આભાર. અશ્વેત, આફ્રિકન અને કેરિબિયન સમાજો જીવંત અને સક્રિય નાગરિકો છે જેઓ બ્રમ્પટનના વિકાસમાં અને ખાસ કરીને સંગીત, મનોરંજક રમતગમત અને ભણતરમાં પોતાની સિદ્ધિઓ

મારફત શહેરને ઉન્નત કરવામાં યોગદાન આપે છે. અમારી આસ્થા છે કે આ યુનિટ નીતિઓના સર્જનમાં જાણકારી પૂરી પાડશે અને અશ્વેત નાગરિકોના જીવનમાં પરિવર્તનકારી બદલાવને ગતિ આપશે.

- એન્જેલા જે કાર્ટર, એગ્રિક્યુલ્ટિવ ડિરેક્ટર, રૂટ્સ કમ્યુનિટી સર્વિસિસ ઇન્ક (Roots Community Services Inc)

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

**મિડિયા સંપર્ક :**

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)